

B.A. Semester - 2 (CBCS) Examination
March/April- 2019 (Old Course)
ECONOMICS : P3 PRINCIPLES OF ECONOMICS-2
(CORE)

Time: 2:30 Hours**Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧	સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના આંતરસંબંધો આકૃતિ દ્વારા સ્પષ્ટ કરો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૧	વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઉદાહરણ દ્વારા સમજાવો.	
પ્રશ્ન-૨	ઘટતા મળતરનો નિયમ સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૨	સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનાં ખ્યાલો ઉદાહરણ અને આકૃતિની મદદથી સમજાવો.	
પ્રશ્ન-૩	વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૩	“નફો જોખમ વહોરવાનું નહિ, પરંતુ અનિશ્ચિતતા વહોરવાનું વળતર છે.” – ચર્ચા કરો.	
પ્રશ્ન-૪	“નફો નવપ્રવર્તનનું પરિણામ છે.” – ચર્ચા કરો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૪	ભાડાનો આધુનિક સિદ્ધાંત સમજાવો.	
પ્રશ્ન-૫	ટૂંકનોંધ લખો. (કોઈપણ બે)	(૧૪)
	(૧) આભાસી ભાડું.	
	(૨) કાયો નફો અને શુદ્ધ નફો વચ્ચેનો તફાવત.	
	(૩) વૈકલ્પિક ખર્ચનાં ખ્યાલની મર્યાદાઓ.	
	(૪) ઉદ્યોગ વિકાસનાં લાભો.	

ENGLISH VERSION

Que-1	Clarify the interrelationship between Average cost and marginal cost with help by diagram.	(14)
	OR	
Que-1	Explain the concept of opportunity cost with the help of illustration.	
Que-2	Explain the law of Diminishing returns.	(14)
	OR	
Que-2	Explain the concept of fixed cost and variable cost with the help of illustration and figure.	
Que-3	Explain the marginal productivity theory of distribution.	(14)
	OR	
Que-3	“Profit is not reward for bearing of risks but reward for bearing of uncertainty” – Discuss.	
Que-4	“Profit is a result of innovation” – Discuss.	(14)
	OR	
Que-4	Explain the modern theory of rent.	
Que-5	Write short notes. (any two)	(14)
	(1) Quasi-Rent.	
	(2) Difference between gross profit and net profit.	
	(3) Limitations the concept of opportunity cost.	
	(4) The advantages of expansion size of industry.	
